



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૫/૦૮/૨૦૧૯ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૧૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૪ કેસ કરી, ૫૦ વ્યક્તિઓને ઝડપી, ૬૦ લીટર દેશી દારૂ, ૯૯ બોટલ ઈંગ્લીશ દારૂ, ૫૫ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૬ બિયર ટીન, ૧ મોટર સાયકલ અને ૧ સ્કૂટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૧૦ કેસ કરી, ૬૦ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧,૩૪,૨૭૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૧૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૬૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૬ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૩૧૯/૧૯

પાલડી: ડૉ.સુરેશભાઈ જયંતીલાલ પરીખ (ઉ.વ.૭૦)(રહે.ત્રાવણકોર હાઉસ પરાગ સોસાયટી સામે નવા વિકાસગૃહ પાલડી) એ તા.૦૪/૦૮/૧૯ ના રોજ પાલડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે માહે જુન/૨૦૧૯ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન આરોપી (૧) અભીષેક નાયર (૨) આર.એમ.તુલાની (૩) રામચંદ્ર બીસ્ટ તથા (૪) બેક એકાઉન્ટ નંબરના અન્ય ધારકોએ ભેગા મળી ડૉ.સુરેશભાઈના પુત્ર તથા પુત્રવધુની એચ.ડી.એફ.સી.લાઈફ ઈન્સ્યોરન્સની પોલીસીના ભરેલ નાણા રીફંડ આપવાનું જણાવી, વિશ્વાસમાં લઈ પ્રીમીયમના નાણા પરત આપવાના બહાને અલગ-અલગ ચાર્જ પેટે કુલ રૂપિયા ૪૨,૨૩,૯૧૭/- અલગ-અલગ બેંકના ખાતામા ભરાવી પોલીસીના નાણા પરત નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી બી.એસ.રબારી ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૩૨૦/૧૯

ચાંદખેડા: યશવંતભાઈ વિનોદભાઈ ગાંધી (રહે.શિવશક્તિનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ ચાંદખેડા) એ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૩/૦૮/૧૯ રાતના ૯/૩૦ થી તા.૦૪/૦૮/૧૯ કલાક ૧૦/૪૫ વાગ્યા દરમ્યાન આઇ.ઓ.સી.રોડ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાન નંબર બી/૧૧૬ “ગાંધી કોમ્યુનિકેશન એન્ડ કન્સલ્ટન્સી” નામની દુકાનના શટરના નકુચા તોડી અજાણી વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી ડ્રોવરમાંથી રોકડ રૂપિયા ૩૮,૮૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જી.વી.ચૌધરી ચલાવે છે.

કૃષ્ણનગર: શૈલેષ રઘુવીરસિંહ કુશવાહ (રહે.વિજય એપાર્ટમેન્ટ અક્ષર સ્કુલની બાજુમા કૃષ્ણનગર) એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૩/૦૮/૧૯ રાતના ૧૧/૦૦ થી તા.૦૪/૦૮/૧૯ કલાક ૭/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી પર્સમાંથી રૂપિયા ૧૨,૫૦૦/- લખેલ ચેક અને રોકડ રૂપિયા ૧૮,૦૦૦/- તેમજ એકટીવાની ચાવી લઈ, ઘરની બહાર પાર્ક કરેલ એકટીવા નંબર જીજે.૦૧.એનયુ ૪૫૫૭ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.એમ.ગોહીલ ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૧૩૨૧/૧૯

એલીસબ્રીજ: મૃનાલ દીલીપ (રહે. જોયાલુક્કાસ શો રૂમની ઉપર પંચવટી એલીસબ્રીજ) એ એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૩/૦૮/૧૯ બપોરના ૧૨/૩૦ વાગ્યાના સુમારે પંચવટી ચાર રસ્તા ખાતે આવેલ “જોયાલુક્કાસ” નામના જવેલર્સના શો રૂમમાં ખરીદી કરવા આવેલ (૩૫ થી ૪૦ વર્ષના આશરાની) એક અજાણી સ્ત્રી દાગીના જોતા-જોતા કાઉન્ટર પર રહેલ નજર ચુકવી સોનાની બંગડી નંગ-૨ કિંમત રૂપિયા ૧,૫૭,૭૦૨/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.બી.વિહોલ ચલાવે છે.

સોનાનું મંગળસુત્ર ખેચી તોડી લઈ ગયા :-

સમાચાર યાદી નં.૧૩૨૨/૧૯

ચાંદખેડા: શ્વેતાબહેન વા/ઓ રાહુલભાઈ પાટીલ (ઉ.વ.૩૨)(રહે.સર્વોદય બલી સોસાયટી સી.એચ.એસ મહાત્મા કુલે રોડ ડોંબાવલી વેસ્ટ મુંબઈ) તા.૦૪/૦૮/૧૯ બપોરના ૩/૫૦ વાગ્યાના સુમારે ચાંદખેડા મોટેરા નિલકંઠ એવન્યુની બાજુમા આવેલ હની-બી સ્કુલ પાસે નરનારાયણ પાર્ટી પ્લોટ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરુષ શ્વેતાબહેનના ગળામાંથી સોનાનું મંગળસુત્ર પેડલ સાથે કિંમત રૂપિયા ૫૫,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ શ્વેતાબહેન પાટીલે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.એસ.ચૌધરી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.